

(ન.પ્ર.બુચ તરીકે જ વીશેષ જાહીતા, લોકદક્ષીકામુતીમાં ઉપનીયામકપદ રહેલા, આજીવન શીક્ષક સ્વ. નટવરલાલ પ્રભુલાલ બુચ આપણા પ્રસીદ્ધ હાસ્યલેખક. તેમની જન્મશતાબ્દી -જન્મ : તા. ૨૧:૧૦:૧૮૮૦ વીદાય : તા. ૮:૧:૨૦૦૨.-નીમિતે આજની મહેનીલમાં તેમની જફૂતીઓ, તેમની પુષ્પસ્મૃતીમાં.)

## ૧: પંચાશીમે પૂજાવે

(સોરઠા)

ચાર વીહું ને ચાર વરહું ઘોડો હંકીયો;  
 ‘જવાળુ’ અસવાર ! અવ ઘોડેથી ઉતરો.  
 થનગનતો તોખાર ગઢાપચ્છીસી તણો,  
 ખેંચી ખેંચી ભાર, હવે થયો છે ટારહું.  
 હવે લાગતો થાક, ઈન્દરીયું મોળી પડી,  
 ઘોડાનો શો વાંક ? ચોરાશી પુરાં કર્યો.  
 લીધો-દીધો પ્રેમ, વાટ વટ્યા હળવે મને;  
 પ્રેમ જ આપણ ક્ષેમ, એના ધરવ ન સાંભળ્યા.  
 આમ કહો તો એકલા, દુનીયાને વહેવાર,  
 પણ છૈયે અન્ન-એકલા, પ્રેમાવરણ વચ્ચાળ.  
 જીવન-સૌરભ સાર ‘પુષ્પ’ જતાં મુકી ગયું  
 સમરી વારંવાર ભર્યું ભર્યું મન રાખીએ.  
 જાવાને તૈયાર, રે’વામાં વાંધો નથી,  
 જીવાળુ અસવાર ! હળવે હૈયે હાલશું.  
 લગામ રાખી હાથ હંક્યે રાખો ટારહુંઃ  
 ‘નટ’નાગરના નાથ ! ઈશારે અટકી જશું.  
 લખ્યાતા. ૨૧:૧૦:૧૮૮૦.

૦૦૦૦૦૦

## ૨: યાચે શું ચીનગારી ?

યાચે શું ચીનગારી, મહાનર,  
 યાચે શું ચીનગારી ? .....મહાનર.

ચકમક -લોહું મેત્ય પડ્યું ને

બાકસ લે કર ધારી;  
કેરોસીનમાં છાણું બોળી  
ચેતવ સગડી તારી. ....મહાનર.

ના સળગ્યું એક સગડું તેમાં  
આફત શી છે ભારી ?  
કાગળના હુચા સળગાવી  
લેને શીત નીવારી. ....મહાનર.

ઠંડીમાં જો કાયા થથરે,  
બંડી લે ઝટ ધારી;  
બે-ત્રણા ઘાલા ચા પી લે કે  
ઝટ આવે હુશીયારી. ....મહાનર.  
(હરીહર પ્રા. ભંનના ‘એક જ દે ચીનગારી’ નું પતીકાવ્ય.)

૦૦૦૦૦૦

### **૩ : વીચારનો ટ્રસ્ટી (મુક્તાક)**

(મિશ્રોપજાતી)

વીચારસમૃદ્ધી તમામ મારી  
વ્યાખ્યાન દ્વારા વીતરું હું વીશમાં  
આચાર માટે ન કશુંય રાખી—  
વીચારનો ટ્રસ્ટી જ માનતો મને.

૦૦૦૦૦૦

### **૪ : કેં નથી (પાદપુતી)**

રુહ-એ-હુનીયા પે જો હીન્દોસ્તાં નથી તો કેં નથી;  
ખુબસુરત જીસમાં જો જાં નથી તો કેં નથી;  
બંગલામાં બાબલાની બા નથી તો કેં નથી;  
નીત સવારે ને બપોરે ચા નથી તો કેં નથી.

૦૦૦૦૦૦

## ૫ : હાઈકુ:

અંગોળ ભાષા  
વહુ વીદેશી  
વર વહુઘેલો, મા  
ને દીદી વીલાં.

પ્રેમવરણ  
વાટે મળીયાં,  
હરચાં, હસવામાંથી  
થયું ખસવું.

લગ્ન  
કોંતલ ઘોડો  
ગારે ખુંત્યો; નીકળ્યો  
ત્યારે ટારું!

કાળી  
સાસુ વહુથી  
ગુરુજનો શીખ્યોથી  
ફરે હરતાં.


સાચી લોકશાહી  
કુંભાર કરતાં  
ગઘેડાં હાથ્યાં; સાચી  
લોકશાહીમાં.

વીરહ-હાઈકુ ... ૧  
નહાઉં-ઘોઉં;  
સાહીસુને દોરહે  
ઘોતીયું રહે.

વીરહ-હાઈકુ... ૨  
રંગીન ઘ્યાલા-  
-વીંઠી ઘઉંવણી ચાઃ  
તમે સાંભય્યો.

વીરહ-હાઈકુ....૩  
જ્યાં જ્યાં નજર  
કરે નટનાગર  
યાદી તમારી.

સ્વ. નટવરલાલ પ્રમુલાલ બુચ



## મહેશ્વરીલે બુચ

### ન.પ્ર.બુચ

(જન્મ : તા. ૨૧-૧૦-૧૯૮૫.. અવસાન : તા. ૮-૧-૨૦૦૦)

ગુજરાતી સાહીત્યનું “સ્વ.જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારીતોષીક” (૧૯૮૮) અને “દર્શકશીક્ષણએવોર્ડ” (૧૯૯૫) મેળવનાર સ્વ.ન.પ્ર.બુચનું આ જન્મશતાબ્દીવર્ષ છે. તેમનો પરીચય સાહીત્યકાર તરીકે, શીક્ષક રૂપે અને વીશેષ તો સંતોની જીવનશૈલીથી જીવી જનાર વ્યક્તી રૂપે આપી શકાય.

સાહીત્યકાર તરીકે તેમણે ગાંધી-પદ્ધતિ બંનેમાં ગુજરાતી સાહીત્યનું બેનમુન સાહીત્ય પીરસ્યું છે. જ્યારે એમનાં અનુવાદોએ એમનું ભાષાપ્રભુત્વ સીદ્ધ કરી આપ્યું છે.

તેઓ આજીવન શીક્ષક રહ્યા. વર્ગમાં એક મીનીટ પણ મોડા ન પહનાર; શીક્ષણવર્ગમાં પાઠ્યપુસ્તકોની અને વર્ગ બહાર જીવનના પાઠોની જીણામાં જીણી વીગતો સરળતાથી અને આત્મીયતાથી શીખવનાર, તેઓ કેવળ વીદ્યાર્થીઓના જ નહીં, વાલીઓના અને સંસ્થાના નાનામોટા સૌ કોઈના સર્વસ્વીકૃત વાલી રહ્યા.

મોરારીબાપુ તેમને ‘સાધુચરીત’ કહે કે ‘દર્શક’ તેમને ‘સદ્ગુરુ વીદેહી’ કહે ત્યારે તેમનો કંઈક પરીચય પ્રાપ્ત થાય છે.

પુછોંની ફર્યુસન કોલેજમાંથી ૧૯૮૦માં સંસ્કૃત-અંગ્રેજી સાથે એમ.એ. થયા. ૧૯૮૮માં રાષ્ટ્રીય રંગે રંગાયા. ૧૯૮૦માં જ ગુજરાતના શીક્ષણક્ષેત્રના જ્યોતીર્ધર નાનાભાઈ ભહુ સાથે જોડાયા અને અંત સુધી તેમની સંસ્થાઓમાં રહ્યા. સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષાઓના ઉંડા અભ્યાસી; લેટીન, મરાठીના જાણકાર એવા સ્વ.બુચસાહેબ જીવનના છેલ્લા દાયકામાં ફેંચ પણ શીખતા રહ્યા ! ભાષાની સુક્ષમાતીસુક્ષમ શક્તીઓને તેમણે ઓળખી અને યથાવકાશ પ્રયોજી બતાવી.

મીરાં, પ્રેમાનંદ, દલપતથી માંડીને હ. ભહુ; હ. હ. ધૂવ; પ્રે. ન. ભહુનાં કેટલાંક ભજનો, કાવ્યોનાં અદ્ભુત કહી શકાય તેવાં પ્રતીકાવ્યો દ્વારા તેઓ ગુજરાતી સાહીત્યના યાદગાર હાસ્ય-લેખક બની રહ્યા. તેમનાં ગાંધી-પદ્ધતિ લખાણોમાં અલંકારોની ચમત્કૃતી તો અમાસના આકાશમાંના તારાઓની જેમ જબુકતી અનુભવવા મળે છે.

અનપેક્ષ અને અઢળક પ્રેમ તેમણે સૌમાં વહેંચ્યો. સૌને કેવળ આપતા જ રહ્યા. જન્મજયંતી નીમીતે તેમને અંજલી આપીને તેમની વંદના કરીએ.

.....  
સંકલન અને સંપાદન: બળવંતપટેલ (ગાંધીનગર) અને જુગલકીશોર વ્યાસ (અમદાવાદ)

‘વીજ્યા ફ્લેન્ટ’માં અને ‘ઉઝાજોહણી’માં અક્ષરાંકન : જુગલકીશોર વ્યાસ :

j\_jugalkishor@yahoo.co.in

‘સન્દેશ-મહેશ્વરીલ’ -- વર્ષ : બે -- અંક : ૭૩ -- ઑક્ટોબર ૨૮, ૨૦૦૬

## બુચસાહેબ વીશે થોડુંક વીશેષ

તમે જુનાગઢની શેરીમાં લટાર મારવા નીકળ્યા હો અને રસ્તામાં નરસીછ મહેતા મળી જાય અને તમે તેને ઉભા રાખીને પુછો કે "મહેતા, આ તારો શામળોજુ કોણ?" અને પછી તેમની આંખોમાં જે અહોભાવ ગ્રગટે તેવો જ અહોભાવ બુચભાઈના સંપર્કમાં આવેલા, મારા જેવા કોઈને પણ, "આ તમારા બુચભાઈ કોણ?" એમ પુછવામાં આવે ત્યારે જોવા મળે...

પછી પુછનારનું તો આવી જ બને. ઘરમાં વાળું માટે વાટ જોતી પત્નીઓ ચુલા પાસે જ બીચારી બેઠી બેઠી સુઈ ગઈ હોય, આગળથી લીધેલી નાટક સીનેમાની ટીકીટો રજણી ગઈ હોય કે જરૂર પકડવી પડે તેવી ટ્રેઇનો ચુકી ગયાના દાખલા બેસુમાર મળે.

બુચભાઈ એ સૌને મળવા જોઈએ તેવા પણ અમારા માટે ખાસ અલાયદા રાખેલા એક બેનમુન શીક્ષક હતા. તેમના વીશે લખવા બેસું તો રામાયણ જેટલું લખાય પણ મારે કોઈને રજણાવવા નથી એટલે એક નાનકડો એવો એક પરીયય કરાવું.

નાગરસહજ આનંદવૃત્તિ પુરી. રસીક! જુંદગીની હર સ્થીતીમાં, હર પળે કંઈક રમુજ ગોતી લાવે. હોસ્પીટલમાં ખાટલે પડ્યા હોય તો સુજે કે "સામાન્ય રીતે બુચ ઉપર અને બાટલી નીચે હોય, પણ આજે બુચ નીચે અને બાટલી ઉપર છે." સીતેર વર્ષે પહેલીવાર એરોપ્લેનમાં બેસવાની તક મળી તો કહે કે "આ તો આપણે રીહર્સલ માટે કર્યું એટલે હવે વીમાન આવશે તેમાં કોઈ વાંધો ન આવે." દાંતની તકલીફ હતી એટલે એકાએક બધા દાંત પડાવી નાખવા પડ્યા. તેનો અનુગમ? "અત્યાર સુધી હું બીજાને દાંત કઢાવતો, આજે બીજો કોઈ મારા કાઢી જ્યો." અને તે પછી ચોકહું કરાયું તો "ચારે બાજુથી કઠે તે ચોકહું" વ્યાખ્યા તેમના અનુભવનો નીચોડ આપે. તેમની છેદ્ધી વર્ષગાંઠે કોઈએ બીજાને પુછ્યું, "બુચભાઈને કેટલાં વર્ષ થયાં?" બીજાએ ગણતરી કરી કહ્યું, "બુચભાઈને ચોરાણું" આ સાંભળી બુચભાઈ બોલ્યા, "મારું કંઈ ચોરાણું નથી." અને બે દીવસમાં બુચભાઈ જ બધાની વચ્ચેથી ચોરાઈ ગયા.

ભાષાઓનો બહુ જ શોખ અને શોખ એટલે લીક્ઝિતથી માણવાની વાત. "સંસ્કૃત મારી દાદી, ગુજરાતી મારી મા અને અંગ્રેજી મારી પ્રીયતમા" એ શબ્દોમાં એ પ્રેમ દેખાઈ આવે.

## અમારા બુચભાઈ કીશોર રાવળ

From Kesuda March 2000, Issue 4 (Kesuda.com)  
Please visit : [www.kesuda.com](http://www.kesuda.com)

[www.kesuda.com](http://www.kesuda.com) ના તંત્રી અને બુચભાઈના વીદાથી, અમેરીકાસ્થીત ભાઈ કીશોર રાવળે બુચભાઈ વીશે એક બહુ જ સરસ લેખ કેસુડાના ઉપરોક્ત અંકમાં કર્યો છે. તેમાંનો એક અંશ, એમની કલમે..આખો લેખ [www.kesuda.com](http://www.kesuda.com) પરથી મળી શકશે.

ગોપીકા ફોન્ટમાં અને ઉઝાજોહણીમાં અક્ષરાંકન: કીશોર રાવળ  
ભાઈ કીશોર રાવળનો ખુબ આભાર..[Uttam.Gajjar@hotmail.com](mailto:Uttam.Gajjar@hotmail.com)-